



ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર

શૈક્ષણિક વર્ષ - 2023-24

ધોરણ-10

વિષય : વિજ્ઞાન (011)

વાર્ષિક પરીક્ષા

સમય : 3 કલાક

પ્રેશ્નપત્રનું પરિચ્છ્ય

ગુણ : 80

નોંધ : આ પરિચ્છ્ય વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રાશ્નકો, મોડરેટર્સ વગેરેના માર્ગદર્શન માટે છે. જે તે વિષયોના પ્રાશ્નિક તેમજ મોડરેટર્સને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના બૃહદ્દ હાર્ડ/ઉદેશને સુસંગત રહી પ્રેશ્નપત્રની સંરચના બાબતે ફેરફાર કરવાની છૂટ રહેશે.

હેતુઓ પ્રમાણે ગુણભાર :

હેતુઓ	જ્ઞાન (K)	સમજ (U)	ઉપયોજન (A)	ઉચ્ચ વૈચારિક કૌશલ્ય		કુલ
				સંયોજન/વિશ્લેષણ	અનુમાન/મૂલ્યાંકન	
ગુણ	20	28	24	04	04	80
ટકા(%)	25%	35%	30%	5%	5%	100%

પ્રેશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર :

ક્રમાંક	પ્રેશ્નો પ્રકાર	પ્રેશ્નોની સંખ્યા		કુલ ગુણ
		જનરલ વિકલ્ય વિના	જનરલ વિકલ્ય સાથે	
1.	હેતુલક્ષી પ્રેશ્નો (O)	24	24	24
2.	ટૂંકજવાબી પ્રેશ્નો (SA-I)	09	13	18
3.	ટૂંકજવાબી પ્રેશ્નો (SA-II)	06	09	18
4.	લાંબા પ્રેશ્નો (LA)	05	08	20
	કુલ	44	54	80

પ્રકરણદીઠ ગુણભાર

ક્રમ	પાઠ/પ્રકરણનું નામ	જનરલ વિકલ્ય વિના ગુણભાર	જનરલ વિકલ્ય સાથે ગુણભાર
1.	રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ	05	05
2.	એસિડ, બેઇઝ અને કાર	07	10
3.	ધાતુઓ અને અધાતુઓ	07	10
4.	કાર્બન અને તેનાં સંયોજનો	06	06
5.	જૈવિક કિયાઓ	08	14
6.	નિયંત્રણ અને સંકલન	06	06
7.	સજ્વાં કેવી રીતે પ્રજનન કરે છે ?	06	10
8.	આનુવંશિકતા	03	03
9.	પ્રકાશ - પરાવર્તન અને વકીભવન	08	08
10.	માનવ-આંખ અને રંગબેંગળી દુનિયા	05	09
11.	વિદ્યુત	08	10
12.	વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો	05	08
13.	આપણું પર્યાવરણ	06	10
	કુલ	80	109

નોંધ : જનરલ વિકલ્ય સાથે દર્શાવેલ પ્રેશ્નના ગુણ નમૂનાના પ્રેશ્નપત્ર પ્રમાણે દર્શાવેલ છે અન્ય પ્રેશ્નપત્ર માટે આ ગુણ અલગ હોઈ શકે છે.



ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
શૈક્ષણિક વર્ષ - 2023-24

ધોરણ-10

વિષય : વિજ્ઞાન (011)
વાર્ષિક પરીક્ષા

સમય : 3 કલાક

પ્રેશનપત્રનું માળખું

ગુણ : 80

પ્રેશન ક્રમ	વિભાગ તથા પ્રેશની વિગત	ગુણ
	વિભાગ-A	24
1 થી 24	બધા પ્રેશનો ફરજિયાત રહેશે (દરેક સાચા ઉત્તરનો 1 ગુણ) આ વિભાગમાં હેતુલક્ષી પ્રેશનો જેવા કે MCQ, MRQ, ખરાંખોટાં, ખાતીજગ્યા, વ્યાખ્યા, સૂત્રો, એકમો, અતિદ્વંદ્વ જવાબી પ્રેશનો, એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપો, પુરુંનામ આપો, શોધ, શોધકો, આકૃતિમાં ભાગ ઓળખો, આપેલ શબ્દો પૈકી અસંગત ઓળખો. કમમાં ગોઠવો, આલેખ આધારિત પ્રેશનો, ચિત્ર ઓળખો, વિધાન કારણ સંબંધ ચકાસતા પ્રેશનો પૂર્ણ કરો, જોડકાં (1 ગુણ) વગેરે પ્રકારના પ્રેશનો પૂર્ણ શકાય. કોઈપણ પ્રકારના પ્રેશનો 6 થી વધી ન જાય તેની કાળજી લેશો.	
	વિભાગ-B	18
25 થી 37	પ્રેશનક્રમાંક 25 થી 37 (દરેક સાચા ઉત્તરના 2 ગુણ) કુલ 13 પ્રેશનોમાંથી કોઈપણ 9 પ્રેશનોના સાચા જવાબ લખો (40 થી 50 શબ્દોની મર્યાદામાં)	
	વિભાગ-C	18
38 થી 46	પ્રેશનક્રમાંક 38 થી 46 (દરેક સાચા ઉત્તરના 3 ગુણ રહેશે) કુલ 9 પ્રેશનોમાંથી કોઈપણ 6 પ્રેશનોના જવાબ આપો.	
	વિભાગ-D	20
47 થી 54	પ્રેશનક્રમાંક 47 થી 54 (દરેકના સાચા ઉત્તરના 4 ગુણ) કુલ 8 પ્રેશનોમાંથી કોઈપણ 5 પ્રેશનોના જવાબ આપો.	
	કુલ ગુણ	80



ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર

શૈક્ષણિક વર્ષ - 2023-24

ધોરણ-10

વિષય : વિજ્ઞાન (011)

વાર્ષિક પરીક્ષા

સમય : 3 કલાક

પ્રશ્નપત્રનું પરિચ્છ્ય

ગુણ : 80

સૂચનાઓ :

- તમામ વિભાગ ફરજીયાત છે. સૂચનાની સામે બતાવવામાં આવેલી સંખ્યા વિભાગના કુલ ગુણ દર્શાવે છે.
- જરૂર જણાય ત્યાં સ્વચ્છ પ્રમાણસર અને નામનિર્દેશિત આકૃતિ દોરવી.
- પ્રશ્નોના જવાબ વિભાગ પ્રમાણે જ કમસર લખવા.

વિભાગ A ડેતુલક્ષી પ્રશ્નો

- પ્રશ્ન કમ 1 થી 24 ના જવાબ સૂચના મુજબ લખો. (દરેક પ્રશ્નનો 1 ગુણ) (24)
- નીચે આપેલાં વિધાનો માટે તેમની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો

 - હળદર બેઈજ પદાર્થ સાથે કેવો રંગ આપે છે ?
(A) પીળો (B) કદ્ધાઈ પડતો પીળો (C) લાલાશ પડતો કદ્ધાઈ (D) કાળો
 - નીચેનામાંથી કયા સંયોજનોમાં -OH કિયાશીલ સમૂહ હોય છે ?
(A) બ્યુટેનોન (B) બ્યુટેનોલ (C) બ્યુટેનોઈક એસિડ (D) બ્યુટેનાલ
 - પાચનમાર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે ?
(A) જદર (B) મુખગુહા (C) મોટુ આંતરું (D) નાનુ આંતરું
 - વિદ્યુતપ્રવાહનો એકમ લખો.
(A) કુલંબ (B) એમ્પીયર (C) વોલ્ટ (D) ઓફ્સ
 - શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે તમે નીચે આપેલ પૈકી શું પસંદ કરશો ?
(A) અંતર્ગોળ લેન્સ (B) બહીગોળ લેન્સ
(C) અંતર્ગોળ અરીસો (D) બહીગોળ અરીસો
 - પ્રેસબાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચેરમા પહેરતી હશે?
(A) બાયક્ઝોકલ (B) નણાકારીય લેન્સ (C) બહીગોળ લેન્સ (D) અંતર્ગોળ લેન્સ

- નીચે આપેલ વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો :

 - આલ્ફેન સમાનધર્મી શ્રેષ્ઠીનો પ્રથમ સત્ત્ય છે. (ઈથેન, મિથેન, પ્રોપેન)
 - શોર્ટસર્કિટ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે. (ખૂબ જ ઘટી જાય, સતત બદલાય, ખૂબ જ વધી જાય)
 - ઉરોદરપટલ તંત્રનું અંગ છે. (પાચન, શ્વસન, ઉત્સર્જન)
 - પિતૃઓનાં લક્ષણો માંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉત્તરી આવે છે. (કોષરસ, જનીન, રિબોજોમ)

11. એક ગોળીય અરીસા અને એક પાતળા ગોળીય લેન્સ દરેકની કેન્દ્ર લંબાઈ -15cm છે. અરીસો અને લેન્સ..... હશે. (બન્ને અંતર્ગોળ, બન્ને બહિગોળ, અંતર્ગોળ અરીસો અને બહિગોળ લેન્સ)
12. ધાતુ પ્રવાહી સ્વરૂપે છે. (પારો, કેલિશયમ, સોડિયમ)
- નીચે આપેલા વિધાનો સાચાં છે કે ખોટાં તે લખો
13. સીસું, કોપર, ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રકિયા કરતી નથી.
14. લેસ્માનીયામાં પ્રજનન દ્વિભાજન દ્વારા થાય છે.
15. ક્રીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરતી નથી.
16. ખાટા દહીમાં એસિટિક એસિડ હોય છે.
- નીચે આપેલા પ્રશ્નોના માંયા મુજબ જવાબ આપો.
17. રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કયાં અંતઃ સ્ત્રાવ દ્વારા થાય છે ?
18. મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજુ પેઢી દરમ્યાન મળતી સંતતિના બંધારણ TT, Tt, tt છે. આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રદૂન્ન બંધારણને અલગ પાડો.
19. નીચેનામાંથી બંધબેસતી ના હોય તેવી જોડ શોધીને લખો.
- (A) નેત્રપટલ - પ્રકાશસંવેદી પડદો
 - (B) કન્નીનિકા - સ્ફટિકમય લેન્સ
 - (C) ક્રીકી કન્નીનિકા વડે રચાતી છિદ્ર જેવી રચના
20. ઓક્સના નિયમનું ગાણિતીક સૂત્ર લખો.
- જોડાં જોડો :
- | | |
|-----------------------|---------------------------------------|
| વિભાગ અ | વિભાગ બ |
| 21. ઓક્સિજન | (a) કોષ વિભાજનને પ્રેરીત કરે છે. |
| 22. એબ્સેસિક એસિડ | (b) પ્રકંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. |
| | (c) વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે. |
| વિભાગ અ | વિભાગ બ |
| 23. દ્વિત્ય પોષક સ્તર | (a) દ્વિત્ય ઉપભોગીઓ |
| 24. તૃતીય પોષક સ્તર | (b) પ્રાથમિક ઉપભોગીઓ |
| | (c) ઉત્પાદકો |

વિભાગ - B

- પ્રશ્ન કમ 25 થી 37 પૈકી કોઈપણ 9 પ્રશ્નોના 40 થી 50 શબ્દોની મર્યાદામાં માંયા મુજબ ઉત્તર લખો. (દરેક પ્રશ્નના 2 શુણ)
- [18]
25. તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઈટ્રોજન વાયુને શા માટે ભરવામાં આવે છે?
26. અધાતુના કોઈપણ ચાર ભૌતિક ગુણધર્મો જણાવો.
27. માનવ ઉત્સર્જનતંત્રની નામ નિર્દેશનયુક્ત આકૃતિ દોરો.
28. પાનકૂટીમાં વાનસ્પતિક પ્રજનન સમજાવો.

29. એક કાર્યક્રમ દરમિયાન એક ડોક્ટર દ્વારા વિદ્યાર્થીઓને જાતીય શિક્ષણ સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું.. તેમણે જણાવ્યું કે જાતીય સમાગમમાં શારીરિક સંબંધ પ્રસ્થાપિત થતો હોવાથી. તેમાં ગોનોરીયા, એઈડ્સ, સિફિલિસ તથા મસા જેવા બેક્ટેરિયાજન્ય તથા વાઈરસજન્ય રોગોનું કયારેક સંક્રમણ થઈ શકે છે. આ કાર્યક્રમમાં યાંત્રિક અને રાસાયણિક પદ્ધતિઓ દ્વારા વસ્તી નિયંત્રણ કરી શકાય છે તે સમજાવવામાં આવ્યું. જેમાં નિરોધનો ઉપયોગ, આંકડીનો ઉપયોગ, કોપર-ટીનો ઉપયોગ, સ્ત્રી નસબંધી, પુરુષ નસબંધી જેવી પદ્ધતિઓની જાણકારી આપવામાં આવી. તો ઉપરોક્ત ચર્ચા પરથી નીચેના પ્રશ્નનો જવાબ આપો.
- જાતીય સમાગમ દ્વારા ફેલાતા રોગોને બેક્ટેરિયાજન્ય અને વાઈરસજન્ય રોગોમાં વર્ગીકૃત કરો.
 - વસ્તી નિયંત્રણ માટેની યાંત્રિક પદ્ધતિઓ માટે કોઈપણ બે સાધનોના નામ જણાવો
30. ભયદર્શક સિગનલોમાં પ્રકાશનો રંગ લાલ રાખવામાં આવે છે વૈજ્ઞાનિક કારણ આપો.
31. કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ તારમાંથી 0.5 A વિદ્યુતપ્રવાહ 10 મિનિટ સુધી રહે છે તો પરિપથમાં વહન પામતો વિદ્યુતભાર ગણો.
32. તફાવત આપો: શ્રેષ્ઠી જોડાણ - સમાંતર જોડાણ.
33. ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ લખો. આ સિદ્ધાંત પર કાર્ય કરતા કોઈપણ બે વિદ્યુત ઉપકરણોના નામ જણાવો.
34. તફાવત આપો: જૈવવિઘટનીય પદાર્થો - જૈવઅવિઘટનીય પદાર્થો
35. નિવસનતંત્ર એટલે શું ? તેના ઘટકો જણાવો.
36. આકૃતિમાંથી નીચે આપેલ ભાગોના નામ શોધો:(હાબું કણ્ણક, જમણું ક્ષેપક, આરોહી ધમનિકંડ, આંતર ક્ષેપક પટલ)



37. ફ્યુઝ વિશે ટૂકમાં સમજ આપો.

વિભાગ - C

- પ્રશ્ન કુમ 38 થી 46 પૈકી કોઈપણ 6 પ્રશ્નોના 60 થી 80 શાબ્દોની મર્યાદામાં માણ્યા મુજબ [18] ઉત્તર લખો. (દરેક પ્રશ્નના 3ગુણ)
38. વિઘ્નટન પ્રક્રિયા એટલે શું ? કોઈ એક ઉદાહરણ રાસાયણિક સમીકરણ દ્વારા સમજાવો.
39. આયનીય સંયોજનોના ગુણધર્મો સમજાવો.
40. ધાતુ ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો.

41. એક અવલોકનમાં જોવા મળ્યું કે

- એક બંધ ઓરડામાં મૂકેલ છોડનું પ્રકાંડ ખુલ્લી બારી તરફ વળેલું હતું. જ્યાંથી સૂર્યપ્રકાશ આવતો હતો.
 - ખુલ્લા મેદાનમાં ઉગેલ છોડનું પ્રકાંડ ઉપરની તરફ વિકાસ પામે છે તથા મૂળ જમીનની તરફ અંદર વિકાસ પામે છે.
- ઉપરોક્ત બંને ઘટનાઓ માટેનું કારણ જણાવો.

42. (a) માદા પ્રજનનતંત્રની નામ નિર્દેશનયુક્ત આકૃતિ દોરો.

- વ્યાખ્યા આપો: જરાયુ

43. પુષ્પના આયામ છેદની નામ નિર્દેશન યુક્ત આકૃતિ દોરી સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન સમજાવો.

44. ગ્રાણ માધ્યમના વકીભવનાંક નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે.

માધ્યમ	વકીભવનાંક
A	1.6
B	1.8
C	1.5

એક કિરણ A માધ્યમમાંથી B માધ્યમમાં પસાર થાય છે અને બીજું કિરણ B માધ્યમમાંથી C માધ્યમમાં પસાર થાય છે.

- ઉપરોક્ત બંને કિરણમાંથી ક્યા કિરણમાં વકીભૂતકિરણ એ લંબ તરફ વાંકું વળશે ?

- ઉપરોક્ત કિરણમાંથી ક્યા કિરણમાં બીજા માધ્યમમાં પ્રકાશની ઝડપમાં વધારો થશે ?

- ઉપરોક્ત બંને કિરણાઓ માટે તમારા જવાબનું કારણ આપો.

45. (a) અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પર મૂકેલી વસ્તુ માટે મળતા પ્રતિબિંબ માટે કિરણાકૃતિ દોરો.

- અંતર્ગોળ અરીસાના કોઈ પણ બે ઉપયોગો જણાવો.

46. સુવાહકનો અવરોધ જેની પર આધાર રાખે છે તે પરિબળોનો અભ્યાસ કરતા પ્રયોગના અંતે નીચે મુજબના અવલોકનો જોવા મળ્યા :

- તારની લંબાઈ બમણી કરતા એમીટરનું અવલોકન તારની મૂળ લંબાઈ વખતે હતું તેના કરતાં અડધું થાય છે.
- પરિપથમાં સમાન લંબાઈનો જીડો તેજ દ્રવ્યનો બનેલો તાર વાપરતાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે છે.
- સમાન લંબાઈ પરંતુ આડછેદનું ક્ષેત્રફળ અલગ અલગ ધરાવતાં હોય તેવા તાર વાપરતા એમીટરનું અવલોકન બદલાય છે.

ઉપરોક્ત અવલોકનોનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો :


- એક વાહક તારની લંબાઈ 2 મીટર છે ત્યારે તેનો અવરોધ 1 ઓક્ટ છે, હવે તે વાહક તારની લંબાઈ 3 મીટર કરવામાં આવે તો તેનો અવરોધ કેટલા ઓક્ટ થશે ?

- 1 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા નિકોમ તારના અવરોધ કરતાં તેટલી જ લંબાઈના 3 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા નિકોમ તારનો અવરોધ વધુ હશે કે ઓછો ?

- વાહક તારનો અવરોધ ક્યા પરિબળો પર આધાર રાખે છે તે જણાવો.

વિભાગ D

46. પ્રશ્ન ક્રમ 47 થી 54 પૈકી કોઈપણ 5 પ્રશ્નોના 90 થી 120 શબ્દોની મર્યાદામાં માણ્યા મુજબ ઉત્તર લખો. (દરેક પ્રશ્નના 4 ગુણ) [20]
47. pH માપકમ વિશે માહિતી આપો અને મનુષ્યના પાચનતંત્રમાં pH નું મહત્વ સમજાવો.
48. ધોવાના સોડાની બનાવટ લખો અને તેના કોઈપણ ચાર ઉપયોગો જણાવો.
49. સાખુની સફાઈક્લિયાની કિયાવિધિ સમજાવો.
50. પોષણના પ્રકાર જણાવી અમીબામાં પોષણ સમજાવો.
51. (a) આકૃતિમાં દર્શાવેલ a,b,c,d ના નામ નિર્દેશન કરો.



- (b) મનુષ્યના જઠરમાં ખોરાકનું પાચન સમજાવો.
52. માયોપીયા(લઘુદસ્તિ)ની ખામી અને તેનું નિવારણ સમજાવો.
53. ઘરેલું વિદ્યુત પરિપથ વિશે આકૃતિ દોરી સમજાવો.
54. (a) ઓઝોન સ્તર વિધટન કેવી રીતે પામે છે તે સમજાવો.
(b) કચરાના નિકાલની સમયાને ઓછી કરવા માટે તમારા વિચાર જણાવો.